

**July 31, 2025**

To,  
BSE Limited,  
P.J. Towers, Dalal Street,  
Mumbai – 400 001

**Scrip Code : 506640**  
**Sub : Newspaper advertisement regarding Special Window for Re-lodgement of Transfer Requests of Physical Shares.**

Dear Sir / Madam,

Pursuant to Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, enclosed herewith the copies of Newspaper advertisement published today i.e. July 31, 2025 in Financial Express (English and Gujarati Edition), informing the shareholders about the commencement of a Special Window for Re-lodgement of Transfer Requests of Physical Shares in accordance with SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSDPoD/P/CIR/2025/97 dated July 02, 2025.

This is for your information and records.

Yours faithfully,

**For ZR2 Bioenergy Limited**  
**(Formerly known as Gujchem Distillers India Limited)**

**Shital Gurav**  
**Company Secretary and Compliance Officer**  
**Membership No.: A73942**



## FINANCIAL EXPRESS

29

**HDFC BANK** HDFC Bank Ltd, 11th Floor, Tower 'B', Wing 'C', Swastik Universal, Near Valentine Cinema, Piplod, Surat-395007. Gujarat, Mo. 9327977847

### POSSESSION NOTICE

Whereas, the undersigned being the Authorized Officer of the HDFC Bank Limited under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under Section 13(2) read with rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated 02.04.2025 calling upon the Borrowers (1) Manju Textile Through Its Proprietor Prince Rathi (2) Prince Rathi (3) Manish Rathi to repay the amount mentioned in the notice being Rs. 14,63,373.79/- (Rupees Fourteen Lakh Eighty Three Thousand Three Hundred Seventy Three and Seventy Nine paise only) as on 02/04/2025 within 60 days from the date of receipt of this notice.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 9 of the said Rules on this **25th day of July 2025**.

The Borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **HDFC Bank Limited** for an amount of **Rs. 14,79,461.53/-** (Rupees Fourteen Lakh Seventy Nine Thousand Four Hundred Sixty One and Fifty Three paise only) as on **25/07/2025** in loan account No. 82258879 & 85709350 and interest & other charges thereon.

### DESCRIPTION OF IMMOVABLE PROPERTY

All that piece and parcel of property bearing Shop No 112-A (Browser Shop No 116) on 1st Floor (as per Passing Plan 2nd Floor) admeasuring 2800 sq. feet, i.e. 260.22 sq. meters super built up area & 1328 sq. feet, i.e. 123.40 sq. meters carpet area along with undivided share in the land of "DMO Logistic Park A", Situated at land bearing Revenue Survey No 287/1, 291, 292, 293, Block No 256 admeasuring 24079 sq. meters, Town Planning Scheme No 35, Final Plot No 216 Paiki Final Plot No 216/2 + 216/3 totally admeasuring 9958 sq. meters & Revenue Survey No 288/2, Block No 257, Town Planning Scheme No 35, Final Plot No 218 admeasuring 4796 sq. meters totally admeasuring 14754 sq. meters of Moje Village Kumbharia, District Surat and bounded as under: East: Passage & Shop No 101, West: OTS, North: OTS, South: Shop No 115.

Date: 25.07.2025 Place: Surat Sd/- Authorised Officer, HDFC Bank Ltd

### TAMBOLI INDUSTRIES LIMITED

(Formerly Tamboli Capital Limited)

Regd. Office: Mahavir Palace, 8A, Kalubha Road, Bhavnagar 364002  
Telephone: (91) 886 654 1222 / (91) (278) 252 0065, Fax: (91) 278 252 0064  
Email: direct1@tambolindustries.com Website: www.tambolindustries.com  
CIN: L65993GJ2008PLC053613

### NOTICE OF THE 17<sup>th</sup> ANNUAL GENERAL MEETING OF THE COMPANY

NOTICE is hereby given that the 17<sup>th</sup> Annual General Meeting ("AGM") of the Members of the Company will be held on Monday 1<sup>st</sup> day of September 2025 at 3.00 P.M. through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the business as set out in the Notice of AGM. The notice of AGM has been sent in electronic mode to the members whose e-mail id are registered with the Company a copy of which has been emailed to the Members of the Company at their registered email addresses.

Further pursuant to Regulation 36(1)(b) of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 letter providing the web-link, including the exact path, where complete details of the Annual Report is available has been sent to those shareholders who have not so registered their e-mail addresses.

Notice is also hereby given that pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Tuesday, August 26, 2025 to Sunday, August 31, 2025 (both days inclusive) for the purpose of identification of share holders to whom dividend is to be paid and for the purpose of 17<sup>th</sup> AGM of the Company.

Pursuant to Circular No. 14/2020 dated April 08, 2020, Circular No. 17/2020 dated April 13, 2020 issued by the Ministry of Corporate Affairs followed by Circular No. 20/2020 dated May 05, 2020, Circular No. 22/2020 dated June 15, 2020, Circular No. 33/2020 dated September 28, 2020, Circular No. 38/2020 dated December 31, 2020, Circular No. 02/2021 dated January 13, 2021, Circular No. 10/2021 dated June 23, 2021, Circular No. 20/2021 dated December 8, 2021, Circular No. 02/2022 dated May 5, 2022, Circular No. 11/2022 dated December 28, 2022, General Circular No. 09/2023 dated September 25, 2023 and General Circular No. 09/2024 dated September 19, 2024 ("MCA Circulars") other applicable circulars issued by the Securities and Exchange Board of India ("SEBI") including their Circular No. SEBI/HO/CFD/PoP/IR/2023/67 dated October 7, 2023 has permitted the Companies holding of the AGM through VC/OAVM, without the physical presence of the Members at a common venue. In compliance with these circulars and the relevant provisions of the Companies Act, 2013 and SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, the AGM of the Members of the Company will be held through VC/OAVM.

In accordance with the aforesaid Circulars, Notice of AGM along with the Annual Report 2024-25 sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Depositories. Members may note that the Notice of AGM and Annual Report 2024-25 will also be available at the Company's website at www.tambolindustries.com, website of Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com and the AGM Notice is also available on the website of the NSDL (agency providing remote e-voting facility) i.e. www.evoting.nsdl.com. Members can attend and participate in the AGM through the VC/OAVM facility only. The instructions for joining the AGM are provided in the Notice of the AGM. Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum as per Section 103 of the Companies Act, 2013.

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of AGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the AGM ("e-voting"). Detailed procedure for remote e-voting is provided in the Notice of AGM.

The e-voting period begins on Friday, 29.08.2025 at 9:00 a.m. and will end on Sunday, 31.08.2025 at 5:00 p.m. The remote e-voting module shall be disabled by NSDL thereafter. Those Members, who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.

In case Member(s) have not registered their e-mail addresses with the Company/Depository, please follow the instructions as mentioned in the notice of AGM to register their e-mail addresses for obtaining Annual Report and login details for e-voting.

Any person who becomes a member of the company after dispatch of the Notice of the meeting and holding shares as on the cut-off date i.e. Monday, 25<sup>th</sup> August, 2025, may cast their votes by following the instructions and process of remote e-voting as provided in the Notice of the AGM uploaded at website www.tambolindustries.com, www.bseindia.com and NSDL website www.evoting.nsdl.com.

The members who have cast their vote by remote e-voting may attend the meeting but shall not be entitled to cast their vote again. For details relating to remote e-voting, please refer to the Notice of the AGM.

In case of any queries relating to voting by electronic means, please refer to the Frequently Asked Questions (FAQs) and e-voting manual available at www.evoting.nsdl.com, under help section or write an email at evoting@nsdl.co.in or call 18001020990.

BY ORDER OF THE BOARD OF DIRECTORS  
Vipul H. Pathak  
WHOLE-TIME DIRECTOR AND CFO  
DIN: 09391337

**Possession Notice (For Immovable Property) Rule 8(1)**

Whereas, the undersigned being the Authorized Officer of IFL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd.) (IIFL Home Finance Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a Demand Notice dated 11.07.2024 calling upon the borrowers Mr. Pankaj Harikishandas Parekh (Borrower), Mrs. Hema Pankaj Parekh (Co-Borrower) & Ms. Parthvi Pankaj Parekh (Co-Borrower) to repay the amount mentioned in the notice being Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only) as on 10.07.2024 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 11.07.2024.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers / Guarantor and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this **27th day of July of the year 2025**.

The Borrowers / Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **IDBI Bank Limited (IDBI)** for an amount of **Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only)** as on 10.07.2024 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 11.07.2024.

"The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

### DESCRIPTION OF THE PROPERTY

All the Piece and Parcels of Immovable Property i.e. being "Satyam - B" Tower, 12th Floor Penthouse No. Satyam-B-1202, admeasuring 160.00 Sq. Mtrs. (including Terrace and parking) Constructed on Land laying Below and Situated at Village - Vadodra Kasba SIM Basking (S. No. 402, 405, "B" bearing Tika No. 27/12, City Survey No. 3558/1-A, 2971.50 Sq. Mtrs. in the Registration District Vadodra in the State of Gujarat. Bounded by:- East : Open Space, West : Penthouse B-1204, North : Penthouse B-1201, South : Open Space. Together with all and singular the structures and erections thereon, both present and future.

Sd/-  
Date : 27.07.2025, Place : Vadodra Authorized Officer, IDBI Bank Limited

Place: Bhavnagar  
Date : 30/07/2025

**Possession Notice (For Immovable Property) Rule 8(1)**

Whereas, the undersigned being the Authorized Officer of IFL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd.) (IIFL Home Finance Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a Demand Notice dated 11.07.2024 calling upon the borrowers Mr. Pankaj Harikishandas Parekh (Borrower), Mrs. Hema Pankaj Parekh (Co-Borrower) & Ms. Parthvi Pankaj Parekh (Co-Borrower) to repay the amount mentioned in the notice being Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only) as on 10.07.2024 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 11.07.2024.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers / Guarantor and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this **27th day of July of the year 2025**.

The Borrowers / Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **IDBI Bank Limited (IDBI)** for an amount of **Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only)** as on 10.07.2024 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 11.07.2024.

"The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

### DESCRIPTION OF THE PROPERTY

All the Piece and Parcels of Immovable Property i.e. being "Satyam - B" Tower, 12th Floor Penthouse No. Satyam-B-1202, admeasuring 160.00 Sq. Mtrs. (including Terrace and parking) Constructed on Land laying Below and Situated at Village - Vadodra Kasba SIM Basking (S. No. 402, 405, "B" bearing Tika No. 27/12, City Survey No. 3558/1-A, 2971.50 Sq. Mtrs. in the Registration District Vadodra in the State of Gujarat. Bounded by:- East : Open Space, West : Penthouse B-1204, North : Penthouse B-1201, South : Open Space. Together with all and singular the structures and erections thereon, both present and future.

Sd/-  
Date : 27.07.2025, Place : Vadodra Authorized Officer, IDBI Bank Limited

Place: Bhavnagar  
Date : 30/07/2025

BY ORDER OF THE BOARD OF DIRECTORS  
Vipul H. Pathak  
WHOLE-TIME DIRECTOR AND CFO  
DIN: 09391337

**Possession Notice (For Immovable Property) Rule 8(1)**

Whereas, the undersigned being the Authorized Officer of IFL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd.) (IIFL Home Finance Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a Demand Notice dated 11.07.2024 calling upon the borrowers Mr. Pankaj Harikishandas Parekh (Borrower), Mrs. Hema Pankaj Parekh (Co-Borrower) & Ms. Parthvi Pankaj Parekh (Co-Borrower) to repay the amount mentioned in the notice being Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only) as on 10.07.2024 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 11.07.2024.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers / Guarantor and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this **27th day of July of the year 2025**.

The Borrowers / Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **IDBI Bank Limited (IDBI)** for an amount of **Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only)** as on 10.07.2024 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 11.07.2024.

"The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

### DESCRIPTION OF THE PROPERTY

All the Piece and Parcels of Immovable Property i.e. being "Satyam - B" Tower, 12th Floor Penthouse No. Satyam-B-1202, admeasuring 160.00 Sq. Mtrs. (including Terrace and parking) Constructed on Land laying Below and Situated at Village - Vadodra Kasba SIM Basking (S. No. 402, 405, "B" bearing Tika No. 27/12, City Survey No. 3558/1-A, 2971.50 Sq. Mtrs. in the Registration District Vadodra in the State of Gujarat. Bounded by:- East : Open Space, West : Penthouse B-1204, North : Penthouse B-1201, South : Open Space. Together with all and singular the structures and erections thereon, both present and future.

Sd/-  
Date : 27.07.2025, Place : Vadodra Authorized Officer, IDBI Bank Limited

Place: Bhavnagar  
Date : 30/07/2025

BY ORDER OF THE BOARD OF DIRECTORS  
Vipul H. Pathak  
WHOLE-TIME DIRECTOR AND CFO  
DIN: 09391337

**Possession Notice (For Immovable Property) Rule 8(1)**

Whereas, the undersigned being the Authorized Officer of IFL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd.) (IIFL Home Finance Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a Demand Notice dated 11.07.2024 calling upon the borrowers Mr. Pankaj Harikishandas Parekh (Borrower), Mrs. Hema Pankaj Parekh (Co-Borrower) & Ms. Parthvi Pankaj Parekh (Co-Borrower) to repay the amount mentioned in the notice being Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only) as on 10.07.2024 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 11.07.2024.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers / Guarantor and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this **27th day of July of the year 2025**.

The Borrowers / Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **IDBI Bank Limited (IDBI)** for an amount of **Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only)** as on 10.07.2024 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 11.07.2024.

"The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

### DESCRIPTION OF THE PROPERTY

All the Piece and Parcels of Immovable Property i.e. being "Satyam - B" Tower, 12th Floor Penthouse No. Satyam-B-1202, admeasuring 160.00 Sq. Mtrs. (including Terrace and parking) Constructed on Land laying Below and Situated at Village - Vadodra Kasba SIM Basking (S. No. 402, 405, "B" bearing Tika No. 27/12, City Survey No. 3558/1-A, 2971.50 Sq. Mtrs. in the Registration District Vadodra in the State of Gujarat. Bounded by:- East : Open Space, West : Penthouse B-1204, North : Penthouse B-1201, South : Open Space. Together with all and singular the structures and erections thereon, both present and future.

Sd/-  
Date : 27.07.2025, Place : Vadodra Authorized Officer, IDBI Bank Limited

Place: Bhavnagar  
Date : 30/07/2025

BY ORDER OF THE BOARD OF DIRECTORS  
Vipul H. Pathak  
WHOLE-TIME DIRECTOR AND CFO  
DIN: 09391337

**Possession Notice (For Immovable Property) Rule 8(1)**

Whereas, the undersigned being the Authorized Officer of IFL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd.) (IIFL Home Finance Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a Demand Notice dated 11.07.2024 calling upon the borrowers Mr. Pankaj Harikishandas Parekh (Borrower), Mrs. Hema Pankaj Parekh (Co-Borrower) & Ms. Parthvi Pankaj Parekh (Co-Borrower) to repay the amount mentioned in the notice being Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only) as on 10.07.2024 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 11.07.2024.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers / Guarantor and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this **27th day of July of the year 2025**.

The Borrowers / Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **IDBI Bank Limited (IDBI)** for an amount of **Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only)** as on 10.07.2024 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 11.07.2024.

"The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

### DESCRIPTION OF THE PROPERTY

All the Piece and Parcels of Immovable Property i.e. being "Satyam - B" Tower, 12th Floor Penthouse No. Satyam-B-1202, admeasuring 160.00 Sq. Mtrs. (including Terrace and parking) Constructed on Land laying Below and Situated at Village - Vadodra Kasba SIM Basking (S. No. 402, 405, "B" bearing Tika No. 27/12, City Survey No. 3558/1-A, 2971.50 Sq. Mtrs. in the Registration District Vadodra in the State of Gujarat. Bounded by:- East : Open Space, West : Penthouse B-1204, North : Penthouse B-1201, South : Open Space. Together with all and singular the structures and erections thereon, both present and future.

Sd/-  
Date : 27.07.2025, Place : Vadodra Authorized Officer, IDBI Bank Limited

Place: Bhavnagar  
Date : 30/07/2025

BY ORDER OF THE BOARD OF DIRECTORS  
Vipul H. Pathak  
WHOLE-TIME DIRECTOR AND CFO  
DIN: 09391337

**Possession Notice (For Immovable Property) Rule 8(1)**

Whereas, the undersigned being the Authorized Officer of IFL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd.) (IIFL Home Finance Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a Demand Notice dated 11.07.2024 calling upon the borrowers Mr. Pankaj Harikishandas Parekh (Borrower), Mrs. Hema Pankaj Parekh (Co-Borrower) & Ms. Parthvi Pankaj Parekh (Co-Borrower) to repay the amount mentioned in the notice being Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only) as on 10.07.2024 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 11.07.2024.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers / Guarantor and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this **27th day of July of the year 2025**.

The Borrowers / Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **IDBI Bank Limited (IDBI)** for an amount of **Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only)** as on 10.07.2024 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 11.07.2024.

"The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

### DESCRIPTION OF THE PROPERTY

All the Piece and Parcels of Immovable Property i.e. being "Satyam - B" Tower, 12th Floor Penthouse No. Satyam-B-1202, admeasuring 160.00 Sq. Mtrs. (including Terrace and parking) Constructed on Land laying Below and Situated at Village - Vadodra Kasba SIM Basking (S. No. 402, 405, "B" bearing Tika No. 27/12, City Survey No. 3558/1-A, 2971.50 Sq. Mtrs. in the Registration District Vadodra in the State of Gujarat. Bounded by:- East : Open Space, West : Penthouse B-1204, North : Penthouse B-1201, South : Open Space. Together with all and singular the structures and erections thereon, both present and future.

Sd/-  
Date : 27.07.2025, Place : Vadodra Authorized Officer, IDBI Bank Limited

Place: Bhavnagar  
Date : 30/07/2025

BY ORDER OF THE BOARD OF DIRECTORS  
Vipul H. Pathak  
WHOLE-TIME DIRECTOR AND CFO  
DIN: 09391337

**Possession Notice (For Immovable Property) Rule 8(1)**

Whereas, the undersigned being the Authorized Officer of IFL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd.) (IIFL Home Finance Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a Demand Notice dated 11.07.2024 calling upon the borrowers Mr. Pankaj Harikishandas Parekh (Borrower), Mrs. Hema Pankaj Parekh (Co-Borrower) & Ms. Parthvi Pankaj Parekh (Co-Borrower) to repay the amount mentioned in the notice being Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only) as on 10.07.2024 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 11.07.2024.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers / Guarantor and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this **27th day of July of the year 2025**.

The Borrowers / Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **IDBI Bank Limited (IDBI)** for an amount of **Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only)** as on 10.07.2024 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 11.07.2024.

"The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

### DESCRIPTION OF THE PROPERTY

All the Piece and Parcels of Immovable Property i.e. being "Satyam - B" Tower, 12th Floor Penthouse No. Satyam-B-1202, admeasuring 160.00 Sq. Mtrs. (including Terrace and parking) Constructed on Land laying Below and Situated at Village - Vadodra Kasba SIM Basking (S. No. 402, 405, "B" bearing Tika No. 27/12, City Survey No. 3558/1-A, 2971.50 Sq. Mtrs. in the Registration District Vadodra in the State of Gujarat. Bounded by:- East : Open Space, West : Penthouse B-1204, North : Penthouse B-1201, South : Open Space. Together with all and singular the structures and erections thereon, both present and future.

Sd/-  
Date : 27.07.2025, Place : Vadodra Authorized Officer, IDBI Bank Limited

Place: Bhavnagar  
Date : 30/07/2025

BY ORDER OF THE BOARD OF DIRECTORS  
Vipul H. Pathak  
WHOLE-TIME DIRECTOR AND CFO  
DIN: 09391337

**Possession Notice (For Immovable Property) Rule 8(1)**

Whereas, the undersigned being the Authorized Officer of IFL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd.) (IIFL Home Finance Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a Demand Notice dated 11.07.2024 calling upon the borrowers Mr. Pankaj Harikishandas Parekh (Borrower), Mrs. Hema Pankaj Parekh (Co-Borrower) & Ms. Parthvi Pankaj Parekh (Co-Borrower) to repay the amount mentioned in the notice being Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only) as on 10.07.2024 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 11.07.2024.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers / Guarantor and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this **27th day of July of the year 2025**.

The Borrowers / Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **IDBI Bank Limited (IDBI)** for an amount of **Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only)** as on 10.07.2024 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 11.07.2024.

"The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

### DESCRIPTION OF THE PROPERTY

All the Piece and Parcels of Immovable Property i.e. being "Satyam - B" Tower, 12th Floor Penthouse No. Satyam-B-1202, admeasuring 160.00 Sq. Mtrs. (including Terrace and parking) Constructed on Land laying Below and Situated at Village - Vadodra Kasba SIM Basking (S. No. 402, 405, "B" bearing Tika No. 27/12, City Survey No. 3558/1-A, 2971.50 Sq. Mtrs. in the Registration District Vadodra in the State of Gujarat. Bounded by:- East : Open Space, West : Penthouse B-1204, North : Penthouse B-1201, South : Open Space. Together with all and singular the structures and erections thereon, both present and future.

Sd/-  
Date : 27.07.2025, Place : Vadodra Authorized Officer, IDBI Bank Limited

Place: Bhavnagar  
Date : 30/07/2025

BY ORDER OF THE BOARD OF DIRECTORS  
Vipul H. Pathak  
WHOLE-TIME DIRECTOR AND CFO  
DIN: 09391337

**Possession Notice (For Immovable Property) Rule 8(1)**

Whereas, the undersigned being the Authorized Officer of IFL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd.) (IIFL Home Finance Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a Demand Notice dated 11.07.2024 calling upon the borrowers Mr. Pankaj Harikishandas Parekh (Borrower), Mrs. Hema Pankaj Parekh (Co-Borrower) & Ms. Parthvi Pankaj Parekh (Co-Borrower) to repay the amount mentioned in the notice being Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only) as on 10.07.2024 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 11.07.2024.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers / Guarantor and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this **27th day of July of the year 2025**.

The Borrowers / Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **IDBI Bank Limited (IDBI)** for an amount of **Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only)** as on 10.07.2024 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 11.07.2024.

"The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

### DESCRIPTION OF THE PROPERTY

All the Piece and Parcels of Immovable Property i.e. being "Satyam - B" Tower, 12th Floor Penthouse No. Satyam-B-1202, admeasuring 160.00 Sq. Mtrs. (including Terrace and parking) Constructed on Land laying Below and Situated at Village - Vadodra Kasba SIM Basking (S. No. 402, 405, "B" bearing Tika No. 27/12, City Survey No. 3558/1-A, 2971.50 Sq. Mtrs. in the Registration District Vadodra in the State of Gujarat. Bounded by:- East : Open Space, West : Penthouse B-1204, North : Penthouse B-1201, South : Open Space. Together with all and singular the structures and erections thereon, both present and future.

Sd/-  
Date : 27.07.2025, Place : Vadodra Authorized Officer, IDBI Bank Limited

Place: Bhavnagar  
Date : 30/07/2025

BY ORDER OF THE BOARD OF DIRECTORS  
Vipul H. Pathak  
WHOLE-TIME DIRECTOR AND CFO  
DIN: 09391337

**Possession Notice (For Immovable Property) Rule 8(1)**

Whereas, the undersigned being the Authorized Officer of IFL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd.) (IIFL Home Finance Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a Demand Notice dated 11.07.2024 calling upon the borrowers Mr. Pankaj Harikishandas Parekh (Borrower), Mrs. Hema Pankaj Parekh (Co-Borrower) & Ms. Parthvi Pankaj Parekh (Co-Borrower) to repay the amount mentioned in the notice being Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only) as on 10.07.2024 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 11.07.2024.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers / Guarantor and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this **27th day of July of the year 2025**.

The Borrowers / Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **IDBI Bank Limited (IDBI)** for an amount of **Rs. 65,43,261/- (Rupees Sixty Five Lakh Forty Three Thousand Two Hundred Sixty One Only**



